

સિટીનો 2021 નો નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ વર્ચ્યુઅલ માધ્યમ પર ફરી આવી રહ્યો છે.

બ્રમ્પટન, ઓન્ટારિયો (02 જુલાઈ 2021) – સિટી ઓફ બ્રમ્પટનનો નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ ફરી મંગળવાર, 07 જુલાઈ 2021ના રોજથી શરૂ થશે. ફરીથી આ વર્ષે સ્ટાફ અને રહેવાસીઓના આરોગ્યને ધ્યાનમાં લેતા પ્રોગ્રામ ઓનલાઈન હાથ ધરાશે.

નર્ચરિંગ નેબરહૂડ્સનો હેતુ નાગરિક પ્રવૃત્તતામાં સુધારો લાવવાનો છે, નિવાસીઓનું સશક્તિકરણ કરવું જેથી તેઓ પોતાના પાડોશના વિસ્તારને ઉન્નત કરવામાં સક્રિય ભૂમિકા ભજવે અને તેઓ સંસાધનો મેળવી શકે. રહેવાસીઓ પોતાના પાડોશના વિસ્તાર વિશે વધુ જાણકારી મેળવવાના અને પોતાને માટે જે મહત્વનું હોય તેની ઓનલાઈન આપલે કરવા માટે ત્રણ માર્ગો હશે:

- વર્ચ્યુઅલ ટૂર્સ – 15 પ્રોરેકોર્ડેડ ટૂર્સ નિયત તારીખો પર સિટીની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવશે. રહેવાસીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ આ ટૂર (સહેલ) વર્ચ્યુઅલ માધ્યમથી લે અથવા પૂરા પાડવામાં આવેલ ટૂર્સનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે રૂબરૂમાં એકબીજાથી અંતર જાળવી રાખીને આવી ટૂર્સ લઈ શકે છે.
- પાડોશ સર્વેક્ષણ – સિટી સમાજના વિવિધ પાડોશને સમજવા માંગે છે તેમજ તે કે ત્યાં રહેતા નિવાસીઓ એકબીજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. રહેવાસીઓને ઓનલાઈન સર્વેક્ષણમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
- ઓનલાઈન મેપિંગ ટૂર્સ – ઓનલાઈન મેપિંગ ટૂલથી રહેવાસીઓ તેમની ગમતી જગ્યાઓ ઓળખી શકશે તેમજ આખા શહેરમાં તેઓ જે ફેરફારો જોવા માંગતા હોય કે સમસ્યાઓ હોય તેને ઓળખી શકશે.

નર્ચરિંગ નેબરહૂડ્સ વિશે વધુ માહિતી અને વર્ચ્યુઅલ નેબરહૂડ્સ વોકસની આખી સૂચિ માટે અહીં મુલાકાત

લો www.brampton.ca/neighbourhoods.

2020 કાર્યક્રમ

ગત વર્ષે, સિટીએ આખા બ્રમ્પટનમાં 15 નેબરહૂડ્સની વર્ચ્યુઅલ ટૂર કરાવી હતી જેથી બ્રમ્પટનવાસીઓને પ્રવૃત્ત કરી શકાય અને સમાજને ભેગું કરવામાં પ્રોત્સાહન મળી શકે. 2020માં નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ મારફતે પોતાના સમાજને આકાર આપવા માટે 400 કરતા વધુ રહેવાસીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. સિટી દ્વારા 400 કરતા વધુ સર્વેક્ષણના જવાબો પ્રાપ્ત થયા હતાં, અને ઓનલાઈન મેપિંગ ટૂલને

400 કરતા વધુ પિન્સ પ્રાપ્ત કરી હતી. 2020 પરિણામો પર વધુ માહિતી માટે, અહીં મુલાકાત લો www.brampton.ca/neighbourhoods.

સુવાક્યો

“પડોશની વાત આવે જેને તેઓ ઘર ગણે છે ત્યારે આપણા રહેવાસીઓ જ ખરા વિશેષજ્ઞો છે, અને તેઓને પોતાના સમાજ વિશે જે ગમે છે અને તેઓને ત્યાં કેવા પરિવર્તનો જોવા ગમશે તે અંગેના તેમના મત અમૂલ્ય છે. ગત વર્ષના નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામમાં જે બધા સહભાગી થયા તેમનો હું આભારી છું, અને હું આ વર્ષના 15 પાડોશના વિસ્તારોના રહેવાસીઓને હું સહભાગ વધારવા પ્રોત્સાહિત કરું છું. આપ સહુના મત અમારે માટે મૂલ્યવાન છે અને તમે આપણા શહેરના આકાર અપવામાં તમે મારી મદદ કરી શકો છો.”

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

જ્યારે પ્રોવિસ ધીમે ધીમે ફરીથી બધી પ્રવૃત્તિઓ શરૂ કરવાનું ચાલુ રાખે છે અને જ્યારે આપણે COVID-19 મહામારીમાંથી સાજા થઈ રહ્યા છીએ ત્યારે આપણા સમાજનું સ્વાસ્થ્ય અને સલામતી સિટી ઓફ બ્રેમ્પટનમાં અમારા માટે ખૂબ અગત્યની છે. રહેવાસીઓને આ વર્ષના નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામના વિસ્તારોમાં પ્રવાસ કરવાનું આમંત્રણ છે અને આપણા સ્થાનિક પાડોશના વિસ્તારો પર પોતાના મત ઓનલાઈન આપવા આહવાન છે. તમારો અભિપ્રાય મૂલ્યવાન છે, અને તમે અમને ટકાઉ અને અક્ષત સમુદાયો બનાવવામાં મદદ કરવામાં અનિવાર્ય ભૂમિકા ભજવો છો.

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

“નર્ચરિંગ નેબરહૂડ્સ રહેવાસીઓને એવી તક આપે છે જેથી રહેવાસીઓ પોતે જેને ઘર કહે છે તે જગ્યા વિશે જે ગમતું હોય તે શેર કરી શકે અને સિટીની આવનાર પરિયોજનાઓ અંગે માહિતી મેળવીને સ્થાનિક સ્તરે પરિવર્તનને પ્રેરિત કરી શકે. આ વર્ષના નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામમાં સહભાગી થઈને પોતાના સમાજને ઉન્નત કરવામાં સામેલ થવા અમે બ્રેમ્પટનવાસીઓને આમંત્રણ આપીએ છીએ.”

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) ઉપ-પ્રમુખ, વોર્ડ 7 અને 8, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

“સિટી ઓફ બ્રેમ્પટન, ખાતે અમે એવું શહેર બનાવવા પ્રતિબદ્ધ છીએ જે સલામત, ટકાઉ અને સફળતાને વરેલું હોય જેને આપણો વૈવિધ્યસભર સમાજ પોતાના ઘર તરીકે વર્ણવીને ગૌરવ અનુભવે. આ વર્ષે ફરી એક વખત અમે અમારા રહેવાસીઓ સાથે નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ મારફત પ્રવૃત્ત થવા ઉત્સુક છીએ અને ગત વર્ષે જેમણે ભાગ લીધો હતો તેમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.”

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ ધોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ટુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca